



સુરત મહાનગરપાલિકા



રીક્રુટમેન્ટ વિભાગ, પાંચમો માળ, નવી એનેક્ષી બિલ્ડીંગ, મહાનગરપાલિકા કચેરી, મુગલીસરા, સુરત.
ફોન નંબર ૦૨૬૧-૨૪૨૩૭૫૦ થી ૨૪૨૩૭૫૬ (EXT-૨૯૯ તેમજ ૨૩૧)

સુરત મહાનગરપાલિકાની ૮૮૫-માર્શલ(પુરુષ)ની જગ્યાઓ માટે ક્રમાંક : PRO/211, Dt.16/07/2018 થી જાહેરાત પ્રસિદ્ધ કરી નિયત નમૂનામાં મંગાવવામાં આવેલ અરજીના અનુસંધાને માન્ય અરજીના ઉમેદવારોની પ્રથમ તબક્કાની શારીરિક યોગ્યતા ચકાસણી તેમજ પ્રેક્ટીકલ પરીક્ષા તા.૦૬-૦૪-૨૦૨૨ થી તા.૧૩-૦૪-૨૦૨૨ દરમ્યાન યોજાઈ રહેલ છે.

તા.૧૦-૦૪-૨૦૨૨ ના રોજ લોક રક્ષક દળ ભરતી બોર્ડની પણ લેખિત પરીક્ષા આપવા જનાર ઉમેદવારો દ્વારા તા.૧૦-૦૪-૨૦૨૨ ના રોજ સુરત મહાનગરપાલિકાની માર્શલ(પુરુષ)ની પ્રેક્ટીકલ પરીક્ષાની તારીખ બદલી આપવા રજૂઆત કરેલ છે. ઉમેદવારોની રજૂઆતના અનુસંધાને મ્યુનિસિપલ કમિશનરશ્રી, સુરત મહાનગરપાલિકા દ્વારા ઉમેદવારોના હિતને ધ્યાને લઈ, જે ઉમેદવારો તા.૧૦-૦૪-૨૦૨૨ ના રોજ લોક રક્ષક દળ ભરતી બોર્ડની લેખિત પરીક્ષામાં હાજર રહેવાથી અત્રેની તા.૧૦-૦૪-૨૦૨૨ ના રોજની માર્શલ(પુરુષ)ની પ્રેક્ટીકલ ટેસ્ટમાં હાજર રહી શકે તેમ નથી ફક્ત તેવા જ ઉમેદવારોને તા.૧૦-૦૪-૨૦૨૨ ના બદલે તા.૧૩-૦૪-૨૦૨૨ નાં રોજ માર્શલ(પુરુષ)ની પ્રેક્ટીકલ ટેસ્ટ માટે બોલાવવાનો નિર્ણય લીધેલ છે.

જેથી આવા ઉમેદવારોએ તેમના તા.૧૦-૦૪-૨૦૨૨ નાં રોજની માર્શલ(પુરુષ)ની પ્રેક્ટીકલ ટેસ્ટના કોલ લેટરમાં દર્શાવેલા પરીક્ષા સ્થળે તા.૧૩-૦૪-૨૦૨૨ નાં રોજ બપોરે ૦૧-૦૦ થી ૦૩-૦૦ કલાક દરમ્યાન તેમનો તા.૧૦-૦૪-૨૦૨૨ નાં રોજની માર્શલ(પુરુષ)ની પ્રેક્ટીકલ ટેસ્ટનો કોલ લેટર તેમજ લોક રક્ષક દળની લેખિત પરીક્ષામાં હાજર રહ્યા અંગેના આધારભૂત પુરાવાઓની ઝેરોક્ષ નકલ જેવા કે, લોક રક્ષક દળની લેખિત પરીક્ષાનો કોલ લેટર, પરીક્ષામાં હાજર રહ્યા અંગેનો કોઈપણ પુરાવો વિગેરે કાગળો સાથે હાજર રહેવાનું રહેશે.

લોક રક્ષક દળની લેખિત પરીક્ષામાં ભાગ લેનાર ઉમેદવાર સિવાયના ઉમેદવારોએ તા.૧૦-૦૪-૨૦૨૨ નાં રોજની માર્શલ(પુરુષ)ની પ્રેક્ટીકલ ટેસ્ટમાં તેમના કોલ લેટરમાં જણાવેલ નિયત સમયે અને સ્થળે અચૂક હાજર રહેવાનું રહેશે.

વધુ જાણકારી માટે માટે રીક્રુટમેન્ટ વિભાગનો જાહેર રજાના દિવસો સિવાય કચેરી સમય દરમ્યાન ૩૫૩માં અગર તો ફોન નંબર ૦૨૬૧-૨૪૨૩૭૫૦ થી ૨૪૨૩૭૫૬ (EXT-૨૯૯ તેમજ ૨૩૧) પર સંપર્ક કરવો.